

Dev Information Technology Limited

Reg. Office: 14, Aaryans Corporate Park, Near Shilaj Railway Crossing,
Thaltej-Shilaj Road, Thaltej, Ahmedabad - 380 059. (INDIA)
Phone: +91 94298 99852 / 53

www.devitpl.com | info@devitpl.com

Offices: Gujarat | Maharashtra | Rajasthan | Canada
CIN: L30000GJ1997PLC033479



Date: 03rd August, 2023

<p>To, The Manager-Listing Department, The National Stock Exchange of India Limited, Exchange Plaza, Plot No. C/1, G-Block, Bandra Kurla complex, Bandra East, Mumbai-400 051 Trading Symbol: DEVIT</p>	<p>To, The Secretary, BSE Limited Phiroze Jeebhoy Towers, Dalal Street Mumbai -400001 Trading Symbol: 543462</p>
--	---

Sub: Newspaper Advertisement for 'Notice to The Shareholders for Extraordinary General Meeting (EGM)'

Ref.: Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015

With reference to the captioned subject and pursuant to Regulation 47 & 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we, Dev Information Technology Limited (the "Company") are submitting herewith enclosed copy of newspaper cutting regarding the information published for members captioned with 'Notice to shareholders for Extra-ordinary General Meeting' in today's "Business Standard" English edition, Ahmadabad and 'Jai Hind', Gujarati edition (Vernacular Language), Ahmadabad, dated 03rd August, 2023

This is for your information and record.

Thanking you,

Yours faithfully,

For **Dev Information Technology Limited**

Krisa Patel
(Company Secretary & Compliance Officer)
Place: Ahmedabad
Encl: a/a

PUBLIC NOTICE

Notice is hereby given to the public under instruction and on behalf of our client Mr. Nareshbhai Laljibhai Jayanti that.....

Our client is lease owner and possessor of below mention residential property declared that the **Registered Lease Deed** and its **Registration Receipt** registered at Sub-registrar Office Ankleshwar described as under:

Description of Lease Deed	Lessor	Lessee
Vide reg. no. 2994/2003 (original) and 2995/2003(duplicate) sign on dt. 28/11/2003 registered on dt. 06/12/2003	Gujarat Industrial Development Corporation	Mr. Dipak M. Nenvaya

Above mention registered Lease Deed along with Registration Receipt was lost or misplaced from his possession and/or not traceable.

Description of Property

All the piece and parcel of non-agriculture residential property bearing R. Sr. No. 217 paikae Plot No. 908/44 admeasuring area 118.26 Sq.Mtrs. in Housing Sector of the Ankleshwar Notified Area within the Village limits of Bhadkodara, Ta. Ankleshwar, Dist. Bharuch, State Gujarat.

Any Person/s, Bank, Society, Institution, Trust, Group etc. owning any Right of Ownership or Possession or Lien, Claim of whatsoever nature in respect of above said property by way of sale, assign, exchange, mortgage, charge, gift, trust, maintenance, inheritance lease are hereby requested to make the same known in writing with documentary evidence within period of **SEVEN DAYS** from the date of publication of this notice. Upon expiry of which it shall be presumed that there are no claims and that claims, if any have been waived off and issue a Title Certificate in respect of same.

Date: 03/08/2023

Parin V. Patel (Advocate)
Office : F.F. -16, Rajkamal Arcade, Opp. Mamlatdar Office, GIDC, Ankleshwar - 393 002, Mob. No. +91 98255 94695.

Central Bank of India
सेंट्रल बँक ऑफ इंडिया
1911 से आपके लिए 'केवितम' CENTRAL TO YOU SINCE 1911

BRANCH : ALIABADA

APPENDIX-IV [Rule 8 (1)] POSSESSION NOTICE (For Immovable Property)

Whereas The undersigned being the Authorized Officer of Central Bank of India under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of Powers conferred under Section 13 read with rule 3 of Security Interest (Enforcement) Rules 2002, issued demand notice/s Dated 09/05/2023 calling upon the Borrower Hemanshi Cattle Feed Prop. Mr. Hitendrasinh Ajitsinh Jadaje to repay the amount mentioned in the notice being Rs. 6,10,275/- (Six Lakh Ten Thousand Two Hundred Seventy Five Rupees Only) plus interest within 60 days from the date of receipt of the said notice.

The Borrower having failed to repay the entire amount Notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/her under Section 13(4) of the said Act read with rule 8 of the said rules on this 28th July of the Year 2023.

The Borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Central Bank of India for an amount Rs. 6,10,275/- (Six Lakh Ten Thousand Two Hundred Seventy Five Rupees Only) and interest thereon w.e.f. 09/05/2023 (Amount deposited after issuing of Demand Notice U/Section 13(2) has given effect).

"The Borrower's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets."

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

All The Part and Parcel of Immovable Property consisting of land with construction on Plot No. 20/1, of land bearing R.S. No. 395 (NA for residential purpose) Paiki, the property in transaction admeasures total 185.80.67 Sq. Mtrs land area together with construction are (more particularly described in sanad) & Bounded By:

North : 20.00 Ft. Wide Road East : Plot No. 21
South : 25.00 Ft. Wide Road West : Plot No. 20/2

Date : 28/07/2023, Place : Jamnagar Sd/- Authorised Officer, Central Bank Of India

Canara Bank Umbergaon Branch, Umbergaon, Dist. Valsad.

THE SECURITY INTEREST ENFORCEMENT RULES 2002 RULE 8(1) POSSESSION NOTICE (For Immovable Property)

Whereas, The undersigned of being the Authorized Officer of the Canara Bank, Umbergaon Branch under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002(54 of 2002) and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand Notice Dated 17/05/2023 calling upon the (Borrower / Guarantor) Shivaji Maliba More And Shital Shivaji More to repay the amount mentioned in the notice being Rs. 8,13,897.04/- (Rupees Eight Lakhs Thirteen Thousand Eight Ninety Seven and Paise Four Only) as on 09/05/2023 within 60 days from the date of receipt of the said notice with future interest and incidental charges w.e.f. 17/05/2023.

The Borrower/Guarantor having failed to repay the amount, notice is hereby given to the Borrower and Guarantor and the public in general that the undersigned has taken Possession of the property described herein below in exercise of the powers conferred on him under section 13(4) of said Act read with rule 8 of the said Rules On 29th day of July of the year 2023.

The Borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the properties will be subject to the charge of the Canara Bank Umbergaon Branch, for an amount Rs. 8,13,897.04/- (Rupees Eight Lakhs Thirteen Thousand Eight Ninety Seven and Paise Four Only) as on 09/05/2023 within 60 days from the date of receipt of the said notice with future interest and incidental charges w.e.f. 17/05/2023

The Borrower's attention is invited to the provision of sub section (8) of the section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF IMMOVABLE PROPERTY

Flat No 302 Admsg 768 Sftt 1 e 71.37 Sq.mts Super Built Up Area Located On 3rd Floor Of K Bldg Known As Radhika Residency, Solsumba, Umbergaon, Valsad, Gujarat. in the name of title holder Shivaji Maliba More And Shital Shivaji More. The boundaries of the Property are : North : Internal Road, South : Flat No K/303, East : Passage, West : Road

Date : 29/07/2023 | Place : Umbergaon | Authorised Officer, Canara Bank

IDFC FIRST Bank Limited
(erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited)

CIN : L65110TN2014PLC09792

Registered Office: KRM Towers, 8th Floor, Harrington Road, Chetpet, Chennai-600031. TEL: +91 44 4564 4000 | FAX: +91 44 4564 4022.

APPENDIX IV [Rule 8(1)] POSSESSION NOTICE (For immovable property)

Whereas the undersigned being the Authorised Officer of the IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank limited) under the securitization and reconstruction of financial assets and enforcement of security interest act, 2002 and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) rules, 2002 issued a Demand notice dated 02-06-2022 calling upon the borrower, co-borrowers and guarantors 1. New Prakash Engineering Works, 2. Basir Gungu, 3. Iqbalbhai Gungu, 4. Jiluben Iqbalbhai Guma, 5. Nasirbhai Gungu, 6. Sabirbhai Gungu, to repay the amount mentioned in the notice being Rs. 1,40,33,129.15/- (Rupees One Crore Forty Lac Thirty Three Thousand One Hundred Twenty Nine and Fifteen Paise Only) as on 01.06.2022, within 60 days from the date of receipt of the said Demand notice.

The borrowers having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Physical possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of act read with rule 8 of the security interest (enforcement) rules, 2002 on this 30th day of July 2023.

The borrowers in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited) for an amount of Rs. 1,40,33,129.15/- (Rupees One Crore Forty Lac Thirty Three Thousand One Hundred Twenty Nine and Fifteen Paise Only) and interest thereon.

The borrower's attention is invited to provisions of sub-section (8) of Section 13 of the act, in respect of time available, to redeem the secured assets.

Description of the Immovable properties

Property-1:- All That Piece And Parcel Of Immovable Property Comprising Of Flat Bearing No. 303, Admeasuring 46.45 Sq. Mtrs. (Built-Up Area), On Third Floor Of The Residential Building Named "Zamzam Apartment" Constructed On Land Measuring 324.96 Sq. Mtrs. Of Aghat Lakh No. 160 Of The Area Known As "Ghanchovi" Lying And Situated At City Survey No. 3483 & 3484 Paiki Of City Survey Ward No. 4 Of Rajkot City, Taluka & District-Rajkot, In The State Of Gujarat. And Bounded As : East : Flat No. 304 West : Jail Road, North : Flat No. 302, South : Other's Property

Property-2:- All That Piece And Parcel Of Residential Tenement No. 120 Constructed On Land Admeasuring 285.55 Sq. Mtrs. Of City Survey No. 3545 Paiki Of Chalta No. 109 Of City Survey Sheet No. 298 In City Survey Ward No. 4 Lying And Situated At Ganchivad, Sub-District & District-Rajkot, In State Of Gujarat And, Bounded As : East : School No. 48 West : Road, North : Other's Tenement, South : Other's Tenement

Date : 30th July 2023 | Authorised Officer, IDFC First Bank Limited
Place : Rajkot | Loan Account No : 16857540, 16911045 & 33699320. | (erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited)

DEV INFORMATION TECHNOLOGY LIMITED
Corporate Identification Number (CIN) : L30000G1997PLC033479
Regd. Office : 14, Aaryans Corporate Park, Near Shilaj Railway Crossing, Thaltej, Ahmedabad - 380 059, Gujarat, India.
Tel : 079-26304241 | E-mail : cs@devitpl.com | Website : www.devitpl.com

NOTICE TO THE SHAREHOLDERS FOR EXTRAORDINARY GENERAL MEETING (EGM)

NOTICE is hereby given that an Extraordinary General Meeting ("EGM") of the Members of Dev Information Technology Limited ("the Company") will be held on **Friday, September 1, 2023** to consider and transact the business as outlined in the Notice of EGM, which is being circulated for convening the EGM.

As per the General Circular No. 14/2020 dated April 8, 2020, General Circular No. 17/2020 dated April 13, 2020, General Circular No. 22/2020 dated June 15, 2020, General Circular No. 33/2020 dated September 28, 2020, General Circular No. 39/2020 dated December 31, 2020, General Circular No. 10/2021 dated June 21, 2021, General Circular No. 20/2021 dated December 8, 2021, General Circular No. 3/2022 dated May 5, 2022, and General Circular No. 11/2022 dated December 28, 2022 (the "MCA Circulars") and SEBI Circular No. SEBI/HO/CFD/POD-2/PIR/2023/4 dated January 5, 2023, and pursuant to Section 101 of the Act read with relevant rules made thereunder, Notice of EGM is being sent only through electronic mode to those Members who have registered their e-mail address either with the Company or with the Depository.

In accordance with the aforesaid MCA Circulars, Notice of the EGM along with the Explanatory statement is being sent only by electronic mode to those Members whose e-mail addresses are registered with the Company/Depositories. Members may also note that the Notice of EGM is available on the Company's website i.e., www.devitpl.com, on the website of the Stock Exchange i.e., BSE Limited at www.bseindia.com and National Stock Exchange of India Limited at www.nseindia.com and on the website of National Securities Depository Limited ("NSDL") (agency for providing the remote e-voting facility) i.e. at www.nsdl.co.in. All documents referred to in the accompanying Notice and Statement pursuant to Section 102(1) of the Companies Act, 2013 shall be open for inspection in electronic mode by the Members by writing an e-mail to the Company Secretary at cs@devitpl.com.

The Company is providing remote e-voting facility ("remote e-voting") to all its members to cast their votes on all resolutions as set out in the Notice of EGM. Additionally, the Company is providing the facility of voting through e-voting system during the EGM ("e-voting").

Detailed procedure for the remote e-voting/ e-voting facility is provided in the Notice of EGM.

Registration of e-mail address with Company/ DP and obtain User ID and Password for e-voting:

Members who have not registered their e-mail addresses so far are requested to register their e-mail addresses so that they can receive the Notice of EGM of the Company electronically. Members holding shares in demat form are requested to register their e-mail address with the Depository Participant(s) only.

- For Members holding shares in Physical mode - please provide necessary details like Folio No., scanned copy of share certificates (front and back), PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) by e-mail to our RTA, Link Intime India Private Limited on their e-mail address: rnt.helpdesk@linkintime.co.in

- Members holding shares in Demat mode can get their e-mail address registered by contacting their respective Depository Participant or by e-mail to RTA at rnt.helpdesk@linkintime.co.in

The EGM Notice will be sent to the Members holding shares on the cut-off date for the dispatch in accordance with the applicable laws on their registered e-mail addresses in due course.

In case of any queries, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on : 022 - 4886 7000 and 022 - 2499 7000 or send a request at evoting@nsdl.co.in

By Order of the Board,
For Dev Information Technology Limited
sd/- **Krisa Patel**
(Company Secretary & Compliance Officer)

Place : Ahmedabad
Date : August 3, 2023

Bank of Baroda
वैक ऑफ बरौदा
Bank of Baroda

POSSESSION NOTICE (For Immovable property)

Whereas, The undersigned being the authorized officer of the Bank of Baroda under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 01.02.2023 calling upon the borrower Mr. Sahil Vasantlal Patil to repay the amount mentioned in the notice being Rs. 13,06,342.78 (Rupees Thirteen Lacs Six Thousand Three Hundred Forty Two and Seventy Eight Paise only) plus interest and other charges and interest thereon, w.e.f. 01.02.2023 within 60 days from the date of receipt of the said notice.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this the day of 31st day of July of the year 2023.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Bank of Baroda Welfare Hospital Chokdi Branch, Bharuch for an amount of Rs. 13,06,342.78 (Rupees Thirteen Lacs Six Thousand Three Hundred Forty Two and Seventy Eight Paise only) plus interest and other charges and interest thereon, w.e.f. 01.02.2023.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

Equitable Mortgage of all that piece and parcel of N.A. land consisting revenue survey 3 - 1 paiki 4 total adm 10320.00 sq. mtrs or there about, Paiki Plot No. 21/B adm 116.17 sq. mtrs located & situated in vicinity of village - Dungi, Ta. & Dist. - Bharuch, (Gujarat) is owned and possessed by Mr. Sahil Vasantlal Patil and bounded as under: East : Plot No. 21 - A, West : Adj. Survey Number, North : 6.00 mtrs wide Road, South : Plot No. 22 - B.

Date : 31/07/2023 | Authorised Officer, BANK OF BARODA, Welfare Hospital Chokdi Branch, Bharuch. | Place : Bharuch

CFM ASSET RECONSTRUCTION PRIVATE LIMITED (CFM-ARC)
CFM ASSET RECONSTRUCTION PRIVATE LIMITED
Registered Office: Block No. A/1003, West Gate, Near YMCAClub, Sur.no. 835/1+3 S.G. Highway, Makarba, Ahmedabad-380 051 - Gujarat

Corporate Office : 1st Floor, Wakefield House, Spott Road, Ballard Estate, Mumbai - 400 038, EMAIL: ravi.jain@cfmarc.in, CONTACT: 079-66118554e 079 66118555, Mobile: +91 98253 57619

APPENDIX -IV (A) SALE NOTICE (Proviso to rule 8(6)) FOR SALE OF IMMOVABLE PROPERTIES

Auction Sale Notice for sale of Immovable assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to rule 8(6) of the Security Interest Enforcement Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower and Guarantors/ Mortgagees that the below described immovable property(ies) mortgaged/ charged to the Secured Creditor, the Physical Possession of which has been taken by the Authorised Officer of CFM Asset Reconstruction Pvt. Ltd. on 11.03.2023, will be sold on "As is what is", and "No recourse Basis" on 25.08.2023 for recovery of dues Amounting to Rs.35,21,752.75 (Rupees Thirty Five Lac Twenty One Thousand Seven Hundred Fifty Two and paise Seventy Five Only) as on 01.04.2019 and further interest and other costs and expenses thereon due to the secured creditor from Borrower/ Mortgagee - 1. A.Mart Junior, (Borrower) 2. Mrs. Hansaben Khilolani (Co-borrower & Mortgagee) 3. Mr. Dipak Sureshbhai Khilolani (Co-borrower & Mortgagee).

DETAILS OF PUBLIC AUCTION

DESCRIPTION OF PROPERTY	1. All the piece and parcel of Commercial Property: Shop No.124, owned by Ms. Hansaben S. Khilolani and Mr Deepak S Khilolani, admeasuring 25.43 Sq. Mt. and undivided land area of 7.54sq.mtrs on first floor of Jalu Arcade in Registration Dist : Anand, Sub Dist : Vallabh vidhyanagar, CS No.234, which is bounded as follows : Towards East : 1st Floor Shop No.123, Towards West : After leaving OTS Margin, road, Towards North : 1st Floor Shop No.125, Towards South: After leaving OTS Margin, Vidhyanagar Dairy.
2. All the piece and parcel of Commercial Property - Shop No.125, owned by Mr Deepak S. Khilolani and Mrs Hansaben S Khilolani, admeasuring 25.43 Sq. Mt. and undivided land area of 7.54 sq.mtrs on first floor of Jalu Arcade in Registration Dist : Anand, Sub Dist : Vallabh vidhyanagar, CS No.234, which is bounded as follows : Towards East: 1st Floor Shop No.123, Towards West: After leaving OTS Margin, road, Towards North: 1st Floor Shop No.126, Towards South: 1st Floor Shop No.124.	

SECURED DEBT Rs. 35,21,752.75 (Rupees Thirty Five Lac Twenty One Thousand Seven Hundred Fifty Two and paise Seventy Five Only) as on 01.04.2019 and further interest and other cost, expenses and charges thereon.

RESERVE PRICE (R.P) Rs.49,27,000/- (Rupee Forty nine lakhs, twenty seven thousand only)

DATE, TIME AND PLACE OF PUBLICATION 11.00 am to 12.00 pm, 25.08.2023
CFM Asset Reconstruction Private Limited, Block No.1003, West Gate, Near YMCAClub, Sur. No. 835/1+3, SG Highway, Makarba, AHMEDABAD -380 051 GUJARAT.

DETAILS OF TERMS AND CONDITIONS Please visit www.cfmarc.in

DATE OF INSPECTION With Prior appointment of Authorised Officer

LAST DATE & TIME FOR SUBMISSION OF BID DOCUMENT 21.08.2023

EMD Rs. 4,93,000/- (Rupees Four Lac ninety three thousand Only)

Encumbrances if any : Not known to the secured creditor.
For details of Terms and Conditions of Sale please refer to the link provided in Sale Notice on secured Creditor's website i.e. http://www.cfmarc.in

Date : 03.08.2023 | Authorised Officer, CFM Assets Reconstruction Pvt.Ltd., Ahmedabad | Acting as trustee of CFMARC Trust - 4 INDSIND

FORM B PUBLIC ANOUNCEMENT
(Regulation 12 of the Insolvency and Bankruptcy Board of India (Liquidation Process) Regulations, 2016)

FOR THE ATTENTION OF THE STAKEHOLDERS OF AMW MOTORS LIMITED

Sl.No.	PARTICULARS	DETAILS
1.	Name of corporate debtor	AMW Motors Limited
2.	Date of incorporation of corporate debtor	19 th September, 2011
3.	Authority under which corporate debtor is incorporated /registered	Registrar of Companies, Ahmedabad
4.	Corporate Identity No. / Limited Liability Identification No. of corporate debtor	U35204CJ2011PLC067190
5.	Address of the registered office and principal office (if any) of corporate debtor	Bhachau Road, Near Village Kannayaba, Bhuj Kachchh, Gujarat 370020.
6.	Date of closure of Insolvency Resolution Process	22 nd September 2021
7.	Liquidation commencement date of corporate debtor	28 th July, 2023 (Order received on 1 st August 2023)
8.	Name and registration number of the insolvency professional acting as liquidator	Name: Avil Menezes Reg No.: IBS/IBA-001/IP-P00017/2016-2017/10041
9.	Address and e-mail of the liquidator, as registered with the Board	Address: 106, 1 st Floor, Kanakia Atrium 2, Cross Road 'K', Chakala MIDC, Andheri (East), Mumbai 400093 Email: avil@caavl.com
10.	Address and e-mail to be used for correspondence with the liquidator	Address: 106, 1 st Floor, Kanakia Atrium 2, Cross Road 'K', Chakala MIDC, Andheri (East), Mumbai 400093 Email: ip.amwmotors@gmail.com
11.	Last date for submission of claims	31 st August 2023

Notice is hereby given that the Hon'ble National Company Law Tribunal, Ahmedabad Bench has ordered the commencement of liquidation of the AMW Motors Limited on 28th July, 2023 (Order received on 1st August, 2023).

The stakeholders of AMW Motors Limited are hereby called upon to submit their claims with proof on or before 31st September, 2023 to the liquidator at the address mentioned against item 10.

The financial creditors shall submit their claims with proof by electronic means only. All other creditors may submit the claims with the proof in person, by post or by electronic means.

Submission of false or misleading proofs of claim shall attract penalties.

In case a stakeholder does not submit its claims during the liquidation process, the claims submitted by such a stakeholder during the corporate insolvency resolution process under the Insolvency and Bankruptcy Board of India (Insolvency Resolution Process for Corporate Persons) Regulations, 2016, shall be deemed to be submitted under section 38.

Date: 03-08-2023 | Authorised Officer, AMW Motors Limited, Ahmedabad | Place: Mumbai | Avil Menezes | Liquidator of AMW Motors Limited | Reg No.: IBS/IBA-001/IP-P00017/2016-2017/10041 | Authorization for Assignment valid till 08th December 2023

Bank of Baroda
वैक ऑफ बरौदा
Bank of Baroda

PARIVAR CHAR RASTA BRANCH
Yasu Estate, Near Ambe Petrol Pump, Dabholi-Waghodia Ring Road, Vadodra-390025

APPENDIX -IV [Rule 8(1)] POSSESSION NOTICE (Immovable Property)

Whereas, The undersigned being the Authorized Officer of the Bank of Baroda under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of Powers conferred under Section 13(12) read with (Rule-8) the Security Interest (Enforcement) Rules, 2002, issued a Demand Notice Date 02-02-2023 (Published in 02 Newspapers on 22-03-2023) calling upon the Borrowers /Guarantor/Mortgagor Mr. Tejas Ajaybhai Mehta & Ajaybhai Chandrakant Mehta to repay the amount mentioned in the notice being Rs. 12,74,121.28 (Rupees Twelve Lakh Seventy-Four Thousand One Hundred Twenty-One and Paise Twenty-Eight Only) as on 11-01-2023 with further interest and expenses within 60 days from the date of notice/date of receipt of the said notice.

The Borrowers / Guarantor / Mortgagor having failed to repay the amount, notice is hereby given to the Borrowers / Guarantor / Mortgagor and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/her under Section 13(4) of the said Act read with Rule 8 of the said Rules on this 01st day of August of the year 2023.

The Borrowers / Guarantor / Mortgagor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Bank of Baroda for an amount of Rs.12,74,121.28/- (Rupees Twelve Lakh Seventy-Four Thousand One Hundred Twenty-One and Paise Twenty-Eight Only) as on 11-01-2023 and interest plus other charges thereon.

The borrower's attention is invited to provision of sub section (8) of the section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF IMMOVABLE PROPERTY

All that part & parcel of the Immovable Residential Property bearing Flat No. A-202 on 2nd Floor in "Shyamal Residency" (SHYAMAL HOMES) Adm. 82.22 Sq. Mt, built up area and proportionate undivided share Adm. 43.99 Sq. Mt. and proportionate undivided share of road Adm. 4.21 Sq. Mt. being organized and constructed in the land bearing R.S. No. Block No. 231 paiki, C.S. No. 1532 of Mouje/Danteshwar in Registration District and Sub-District - Vadodra. Bounded: East: Adjoining open to sky, West: Adjoining open to sky & common stair case passage, North: Adjoining open to sky, South: Adjoining open to sky & Flat No. 203.

Date: 01.08.2023 | Authorised Officer, Bank of Baroda | Place: Vadodra

Union Bank of India
यूनियन बैंक ऑफ इंडिया
Union Bank of India

Porbandar Branch : Giriraj Chambers, Ground Floor, Near Sahyog Hospital, M G Road, Porbandar - 360 575, Gujarat.

Annexure -13 [Rule 8(1)] POSSESSION NOTICE (For immovable property)

Whereas The undersigned being the authorized officer of Union Bank of India, Porbandar Branch, Giriraj Chambers, Ground Floor, Near Sahyog Hospital, M G Road, Porbandar, 360 575, Gujarat under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement Security Interest Act, 2002 (Act No. 54 of 2002) and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 06.05.2023 calling upon Mrs. Urmilaben Subhashbhai Lodhari (Applicant), Mr. Bharatbhai Murubhai Malayariya (Co-obligant) to repay the amount mentioned in the notice being Rs. 13,28,373.39 (Rupees Thirteen Lakh Twenty Eight Thousand Three Hundred Seventy Three and Paise Thirty Nine Only) interest and other charges thereon within 60 days from the date of receipt of the said notice.

The Borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/her under Section 13(4) of the said Act read with rule 8 of the said rules on this 31th day of July of year 2023.

The Borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Union Bank of India for an amount Rs. 13,28,373.39 (Rupees Thirteen Lakh Twenty Eight Thousand Three Hundred Seventy Three and Paise Thirty Nine Only) as on 06.05.2023 and interest thereon.

The Borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available to the borrower to redeem the secured assets.

Description of Secured Assets

Captioned Property is Residential Flat, situated at "Gayatri Heights" Village : Chhaya, under Porbandar Taluka, Porbandar District, bearing Chhaya Revenue Survey No. 275/1 paiki 1, paiki Part No. A paiki Sq. Mts. 54-75, and Part No. D paiki Sq. Mts. 97-13 and Part No. E paiki Sq. Mts. 02-59, its Total Admeasuring 154-47 Sq. Mts. Only on Ninth Floor Flat No. 902 with existing structure in the name of Mrs. Urmilaben Subhashbhai Lodhari and Bounded as under:

On the East : 6-00 Mtrs. Wide Common Road
On the West : Property of Flat No. 901 and Common Wall
On the North : Remaining part of captioned property and National Highway-8-B
On the South : OTS and Common Passage and Property of Flat No. 903.

Date : 31.07.2023, | Authorised Officer, Union Bank Of India | Place : Porbandar

DEV INFORMATION TECHNOLOGY LIMITED
Corporate Identification Number (CIN) : L30000G1997PLC033479
Regd. Office : 14, Aaryans Corporate Park, Near Shilaj Railway Crossing, Thaltej, Ahmedabad - 380 059, Gujarat, India.
Tel : 079-26304241 | E-mail : cs@devitpl.com | Website : www.devitpl.com

NOTICE TO THE SHAREHOLDERS FOR EXTRAORDINARY GENERAL MEETING (EGM)

NOTICE is hereby given that an Extraordinary General Meeting ("EGM") of the Members of Dev Information Technology Limited ("the Company") will be held on **Friday, September 1, 2023** to consider and transact the business as outlined in the Notice of EGM, which is being circulated for convening the EGM.

As per the General Circular No. 14/2020 dated April 8, 2020, General Circular No. 17/2020 dated April 13, 2020, General Circular No. 22/2020 dated June 15, 2020, General Circular No. 33/2020 dated September 28, 2020, General Circular No. 39/2020 dated December 31, 2020, General Circular No. 10/2021 dated June 21, 2021, General Circular No. 20/2021 dated December 8, 2021, General Circular No. 3/2022 dated May 5, 2022, and General Circular No. 11/2022 dated December 28, 2022 (the "MCA Circulars") and SEBI Circular No. SEBI/HO/CFD/POD-2/PIR/2023/4 dated January 5, 2023, and pursuant to Section 101 of the Act read with relevant rules made thereunder, Notice of EGM is being sent only through electronic mode to those Members who have registered their e-mail address either with the Company or with the Depository.

In accordance with the aforesaid MCA Circulars, Notice of the EGM along with the Explanatory statement is being sent only by electronic mode to those Members whose e-mail addresses are registered with the Company/Depositories. Members may also note that the Notice of EGM is available on the Company's website i.e., www.devitpl.com, on the website of the Stock Exchange i.e., BSE Limited at www.bseindia.com and National Stock Exchange of India Limited at www.nseindia.com and on the website of National Securities Depository Limited ("NSDL") (agency for providing the remote e-voting facility) i.e. at www.nsdl.co.in. All documents referred to in the accompanying Notice and Statement pursuant to Section 102(1) of the Companies Act, 2013 shall be open for inspection in electronic mode by the Members by writing an e-mail to the Company Secretary at cs@devitpl.com.

The Company is providing remote e-voting facility ("remote e-voting") to all its members to cast their votes on all resolutions as set out in the Notice of EGM. Additionally, the Company is providing the facility of voting through e-voting system during the EGM ("e-voting").

Detailed procedure for the remote e-voting/ e-voting facility is provided in the Notice of EGM.

Registration of e-mail address with Company/ DP and obtain User ID and Password for e-voting:

Members who have not registered their e-mail addresses so far are requested to register their e-mail addresses so that they can receive the Notice of EGM of the Company electronically. Members holding shares in demat form are requested to register their e-mail address with the Depository Participant(s) only.

- For Members holding shares in Physical mode - please provide necessary details like Folio No., scanned copy of share certificates (front and back), PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) by e-mail to our RTA, Link Intime India Private Limited on their e-mail address: rnt.helpdesk@linkintime.co.in

- Members holding shares in Demat mode can get their e-mail address registered by contacting their respective Depository Participant or by e-mail to RTA at rnt.helpdesk@linkintime.co.in

The EGM Notice will be sent to the Members holding shares on the cut-off date for the dispatch in accordance with the applicable laws on their registered e-mail addresses in due course.

In case of any queries, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on : 022 - 4886 7000 and 022 - 2499 7000 or send a request at evoting@nsdl.co.in

By Order of the Board,
For Dev Information Technology Limited
sd/- **Krisa Patel**
(Company Secretary & Compliance Officer)

Place : Ahmedabad
Date : August 3, 2023

THE JAIN SAHAKARI BANK LTD.
(Multi State Co-Operative Bank)
Regd. Office : Hira Baug, Khattarali Lane, C.P. Tank Mumbai -400 004
Paldi Branch : Shop No.5A, 6A, 7A, Ashirwad Shopping Centre, Paldi, Ahmedabad-380 006. Tel.079-26576474. Email : jsbtl_paldi@jainbank.co.in

APPENDIX IV (See rule 8(1) POSSESSION NOTICE (For Immovable Property)

Whereas, The undersigned being the Authorised Officer of THE JAIN SAHAKARI BANK Ltd under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest (Second) Act, 2002 and exercise of powers conferred under Section 13 (12) read with (rule 3) of the Security Interest (Enforcement) Rules, 2002 issued Demand Notice dated 25-04-2023 Calling upon the Borrowers Mr. Kashyap Bhargavrai Pandya & Mrs. Khushali Kashyap Pandya to repay the amount mentioned in the notice being Rs. 1,15,22,327/- (Rupees One Crore Fifteen Lacs Twenty Two Thousand Three Hundred Twenty Seven) within 60 days from the date of receipt of the said notice.

The borrowers having failed to repay the amount, notice is hereby given to the borrowers and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with Rule 8 of the Security Interest Enforcement Rules, 2002 on 31/07/2023.

The borrowers' attention is invited to provisions of sub section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Borrowers in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of THE JAIN SAHAKARI BANK LIMITED for an amount Rs. 1,15,22,327/- and interest thereon from 01-04-2023.

DESCRIPTION OF IMMOVABLE PROPERTIES

PROPERTY NO. 1 (Owner - KHUSHALI KASHYAP PANDYA & MR. KASHYAP BHARGAVRAI PANDYA)

ALL THAT PIECES AND PARCEL OF IMMOVABLE PROPERTY BEARING SHOP NO. 7, ADMEASURING 19.36 SQ. MTRS., SITUATED ON GROUND FLOOR, "THE PALM AVENUE" SCHEME OF AADHARSHILA CO. OPERATIVE HOUSING SOCIETY LIMITED TOGETHER WITH UNDIVIDED SHARE IN LAND FORMING PART OF THE ADMEASURING ABOUT 963 SQ. MTRS., BEARING FINAL PLOT NO. 37 PAIKI OF TOWN PLANNING SCHEME NO. 13, (OLD REVENUE SURVEY NO. 300, SITUATED LYING AND BEING WITHIN THE VILLAGE LIMIT OF MOUJE:- CHHANI, TALUKA-VADDODARA-WITHIN THE REGISTRATION SUB-DISTRICT: VADDODARA 4(GORVA) AND DISTRICT VADDODARA.

Bounded as under ;
On the North by Palm Avenue Parking
On the South by T P Road
On the East by Shop No. 8
On the West by Shop No. 6

PROPERTY NO. 2 (Owner - MR. KASHYAP BHARGAVRAI PANDYA)

ALL THAT PIECES AND PARCEL OF IMMOVABLE B/47, ADMEASURING ABOUT 500 SQ. FTS., TOGETHER WITH CONSTRUCTION STANDING THEREON ADMEASURING ABOUT 400. SQ. FTS., OF THE PRABHAT COLONY CO-OPERATIVE HOUSING SOCIETY LIMITED, TOGETHER WITH BEARING NEW FINAL PLOT NO. 455, 468, (OLD FINAL PLOT NO. OF TOWN PLANNING SCHEME NO. 3 SITUATED LYING AND BEING WITHIN THE VILLAGE LIMIT OF MOUJE:- BAPOD, TALUKA:- VADDODARA WITHIN THE REGISTRATION SUB-DISTRICT: VADDODARA 7(CHHANI) AND DISTRICT VADDODARA.

Bounded as under ;
On the North by Society Road
On the South by Plot No. 49
On the East by Society Road
On the West by Plot No.

